

CHALAN NO. ચલણ નં.		Tr.O.S.& 5 Rey) 5 g
G.R.P.W.No. 1 U 32/34, dated -6-51		
From no. l/lde T.O. 9 (a) sub		
chalan of cash paid into the		Treasury sub-Treasury State/ Reserve Bank India as
ટ્રેઝરી / સબ ટ્રેઝરી		
.....પ્રાન્થ ખાતેની માં ભરેલી રોકડ રકમનું ચલન સ્ટેટ / રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા		
To filled in by the remitter નાણાં મોકલનારે ભરવાનું		To be filled in by the Department Officer or the treasury અમલદારે કે તિજોરીએ ભરવાનું ખાતાના
Pay whom tendered (name)નાણાં કોણે પેશ કર્યા (તેનું નામ)name(or designation)and address of the person on whose behalf money is paid જેના તરફથી નાણાં ભરવામાં આવ્યા હોય તે વ્યક્તિનું નામ (અથવા હોદ્દો) અને સરનામું	Head of Account } હિસાબનું સદર :-	
	Order to the Bank બેંકને હુકમ Correct Receive and grant receipts બરાબર છે નાણાં સ્વીકારી પહોંચ આપવી	
	તારીખ :	
	Signature and full designation of the Officer ordering in the money to be paid નાણાં ભરવાનો હુકમ કરનાર અધિકારીની સહી તથા પુરે પુરો હોદ્દો	
	To be used only in the case of remittances to Bank through an Officer or the government સરકારી અધિકારી દ્વારા બેંકમાં થતાં ભરણાં વખતે ઉપયોગમાં લેવું	
Full particulars of the remittance and the authority (if any) મોકલેલ ભરણાંની પુરેપુરી વિગત અને તે અંગેના હુકમ(કોઈ હોયતો)	Amount રકમ રૂ.	
Signature સહી	Total કુલ	Date :- તારીખ:-
(In words) rupees શબ્દોમાં રૂપીયા :		
Received Payment રૂ. મળ્યા . શબ્દોમાં :		Treasury Officer/Agent
Treasurer- ખજાનચી	Accountant- હિસાબનીશ	તિજોરી અધિકારી/એજન્ટ

ભરણાંની વિગત		
ચેક નંબર :-	તારીખ:-	રકમરૂ.:-